

(૩) દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામા અનુસરવાની કાર્યપદ્ધતિ

લાભાર્થી ની પાત્રતા	<p>૧.અરજદાર ૨૧ વર્ષ થી ૪૫ વર્ષ સુધી ના હોવા જોઇએ .</p> <p>૨. અરજદાર સામાજિક અને શૈક્ષણિક પૈકીના રબારી અને ભરવાડ જાતિ ના તથા તે પૈકીની પેટાજાતિના હોવા જોઇએ.</p> <p>૩. અરજદાર ના કુટુંબ ની વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦ સુધી ની હોવી જોઇએ.</p> <p>૪.અરજદારે રેશનકાર્ડ , ચુંટણીકાર્ડ ,આધારકાર્ડ રજુ કરવાનુ રહેશે.</p> <p>૫.અરજદારને સંબંધિત વ્યવસાય /ઉદ્યોગ ધંધાનુ જ્ઞાન / અનુભવ દાખલો રજુકરવાનો રહેશે.</p>
લાભ અંગે ની પુર્વ જરૂરીયતો	<p>૧. નિગમ દ્વારા રબારી અને ભરવાડ જાતિ ના ઈસમો માટે સીધા ધિરાણ લોન હેઠળ દૈનિક વર્તમાન પત્રો મા/સરકારી માધ્યમો દ્વારા જાહેરાત આપવામા આવે ત્યારે સંબંધિત જિલ્લા કચેરીમાથી નિયત સમય મર્યાદામા લોન અરજી પત્રક મેળવવુ.</p> <p>૨.અરજી પત્રક ભરી ઉપર દર્શાવેલ સાધનિક કાગળો સહિત જિલ્લા કચેરીમા સમય મર્યાદા મા રજુ કરવુ.</p>
કાર્યક્રમનો લાભ લેવાની પદ્ધતિ	<p>૧.અરજદારે સમયર્યાદામા સાધનિક કાગળો સહિત ઓનલાઇન અરજી કરવી.</p> <p>૩.નિગમ દ્વારા અરજી પત્રક ચકાસણી.</p> <p>૪. જરૂરી સધનિક કાગળો ની પુર્તતા.</p> <p>૫.માન્ય અરજી પત્રકો ની ઉદ્યોગ /ધંધા પ્રમાણે યાદી તૈયાર કરવી.</p> <p>૬.ઠરાવ મુજબ લાભાર્થી પસંદગી સમિતિ દ્વારા લાભાર્થીઓ ની પસંદગી.</p> <p>૭.લાભાર્થીઓની સ્થળ પર ચકાસણી .</p> <p>૮.લાભાર્થીઓ પાસે જરૂરી દસ્તાવેજીકરણ</p> <p>૯.લોન/રકમ/વ્યવસાયના પ્રમાણમા લોન./ધિરાણ.</p> <p>૧૦.લોન રીકવરી.</p>
ક્ષમતા નક્કી કરવા માપદંડો	<p>૧.ગરીબી રેખા હેઠળ ની આવક મર્યાદાવાળા લાભાર્થીની પ્રથમ પસંદગી.</p> <p>૨.વિકલાંગ/અપંગ/વિધવા/ત્યક્તા/મહિલા અને અનાથ લાભાર્થી.</p> <p>૩.અતિપછાત જાતિ ના લાભાર્થી.</p> <p>૪.રાજ્ય ના સૌથી આર્થિક પછાત તાલુકા પૈકી ના લાભાર્થી ને તથા.</p> <p>૫.આવક મર્યાદામા ઓછી વાર્ષિક આવક ધરાવતા લાભાર્થીને પસંદગી મા અગ્રીમતા આપવામા આવશે.</p>
કાર્યક્રમ મા આવેલ લાભ ની વિગતો	<p>સીધા ધિરાણ ની યોજના અંતર્ગત વિવિધ વ્યવસાય /ઉદ્યોગ માટે રાષ્ટ્રીય પછાતવર્ગ નાણા અને વિકાસ નિગમ. નવી દિલ્હી દ્વારા માન્ય યુનિટ તેમજ રાજ્ય ના કુટીર ઉદ્યોગ દ્વારા નિર્ધારીત કરવામા આવેલ યુનિટ કોસ્ટ મુજબ પસંદગી પામેલ લાભાર્થીઓ ને ૮૫% થી ૯૦% સુધીની લોન વાર્ષિક ૩.૫% થી ૬% ના વ્યાજ દર થી આપવામા આવશે.તેમજ જો નિયમિત હપ્તા ન ભરે તો બાકી હપ્તા પર ૬%નિયમિત વ્યાજ તથા ૧૨% દંડનીય વ્યાજ મળી કુલ -૧૮% વ્યાજ વસુલ કરવામા આવે છે.આ યોજના હેઠળ સહાય (સબસીડી)ની કોઈ જોગવાઈ નથી.</p>
સહાયકી વિતરણની કાર્યપદ્ધતિ	<p>૧.નિગમ અમલીત યોજનામા નિગમ દ્વારા વ્યવસાય /ઉદ્યોગ શરૂ કરવા માટે આર.ટી.જી.એસ.થી રકમ ચુકવવામાં આવશે.</p>

		૨. કોઈ સંજોગોમા જિલ્લા મથકે/ જાહેર સ્થળે કાર્યક્રમથી લાભાર્થીઓ ને રૂબરૂ મા લોન નુ વિતરણ કરવામાં આવશે.
અરજી કયા કરવી કે અરજી કરવા માટે કચેરીમા કોનો સમ્પર્ક કરવો		વર્તમાનપત્રોમાં જાહેરાત પ્રસિધ્ધ થયા બાદ ઓનલાઇન અરજી કરવી. આ અંગે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિ., ગાંધીનગરનો ફોન નં ૦૭૯-૨૩૨૫૬૪૯૧-૯૫
અરજી ફી		વિના મુલ્યે (અથવા જાહેરાત મા જણાવ્યા મુજબ)
અન્ય ફી		લાભાર્થી ની પસંદગી / ચકાસણી બાદ યોગ્ય ઠરેલ લાભાર્થી ને દસ્તાવેજીકરણ અને સ્ટેશનરી ચાર્જ પેટે સમયાંતરે નક્કી કરવામા આવે તે ફી ચુકવવાની રહેશે.
અરજી પત્રક નો નમુનો		જાહેરાત આપ્યા બાદ બહાર પાડવામા આવે છે.
બિડાણો ની યાદી		અરજદાર ની અરજી લાભાર્થી પસંદગી સમિતિ દ્વારા મંજૂર થતા નીચે દર્શાવેલ દસ્તાવેજો સામેલ કરવાના રહેશે. ૧.રેશનકાર્ડ /બી.પી.એલ કાર્ડ /ચુંટણી કાર્ડ ની નકલ ૨.તાજેતરનો અરજદાર નો પાસપોર્ટ સાઈઝ નો ફોટો. ૩.વાર્ષિક આવક/જાતિ ના સક્ષમ અધિકારીના દાખલાની નકલ. ૪.વ્યવસાય /ઉદ્યોગ ની આવડત/અનુભવ અંગે ના પ્રમાણપત્ર. ૫.વ્યવસાય ના સ્થળ અંગે સંબંધિત સત્તાધિકારી પાસે થી મેળવેલ લાયસન્સ ની નકલ. ૬.જામીનદારો ન નિલકત અંગે ના જરૂરી આધાર - પુરાવા.(૭/૧૨ અને ૮અ ના ઉત્તારા અથવા મકાન ની વેરા પહોચ) ૭.મેળવેલ લાયકાત ના પ્રમાણપત્ર ની નકલ. ૮.રાષ્ટ્રીયકુત બેંક ના પાંચ કોરા ચેક ૯.નિગમ ના નામે બોજા નોંધ. ૧૦.આધારકાર્ડ અને આધારકાર્ડ બેંક સાથે સીડીંગ.
પ્રક્રીયા ને લગતી સમસ્યાઓ અંગે કયા સમ્પર્ક કરવો		ઉપરોક્ત દર્શાવેલ સરનામે ટપાલ થી કે ટેલીફોન થી સમ્પર્ક કરી શકાય .